



JAY-1601250102030900 Seat No. _____

M. A. (Sem. III) (CBCS) (W.E.F.-2016) Examination

December – 2019

Economics

(Environmental Economics : Theories)

Time : 2½ Hours]

[Total Marks : 70

- ૧ પર્યાવરણીય અર્થશાસ્ત્રના આંતરવિધા શાખાકીય સ્વરૂપની ચર્ચા કરો. ૧૪
અથવા
- ૧ પેરેટોનો ઈષ્ટતમ સામાજિક કલ્યાણનો ખ્યાલ આકૃતિ દોરી સમજાવો. ૧૪
- ૨ બજાર કાર્યદક્ષતા અને બજાર નિષ્ફળતાની પ્રક્રિયાની સમજૂતી પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં આપો. ૧૪
અથવા
- ૨ જાહેર વસ્તુઓ અને સામાન્ય સંપદાના સંસાધનોની સમજૂતી આપો. ૧૪
- ૩ ટકાઉ-પોષણક્ષમ વિકાસનો ખ્યાલ સમજાવી તેના નિયમો અને નિર્દેશકોની ચર્ચા કરો. ૧૪
અથવા
- ૩ પર્યાવરણ અને વિકાસ વચ્ચેનો સંબંધ વિગતવાર સમજાવો. ૧૪
- ૪ પર્યાવરણીય સંસાધનોના ઈષ્ટતમ ઉપયોગ માટેના સિદ્ધાંતોની ચર્ચા કરો. ૧૪
અથવા
- ૪ નિઃશેષ (પુનઃ અપ્રાપ્ય) સાધનોના ઈષ્ટ ઉપયોગના સિદ્ધાંતો સમજાવો. ૧૪
- ૫ ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) ૧૪
(૧) પર્યાવરણીય અર્થશાસ્ત્ર અને મુખ્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર
(૨) રાષ્ટ્રીય અને પર્યાવરણીય હિસાબી પદ્ધતિનો સમન્વય
(૩) પુનઃ પ્રાપ્ય પર્યાવરણીય સંસાધનોના સિદ્ધાંતો
(૪) વણઉકેલ્યા સંપત્તિ હક્કો.

ENGLISH VERSION

- | | | |
|-----------|--|----|
| 1 | Discuss interdisciplinary nature of environmental economics. | 14 |
| OR | | |
| 1 | Explain the concept of Parato's optimum social welfare with the help of diagram. | 14 |
| 2 | Explain market efficiency and market failures in the context of environment. | 14 |
| OR | | |
| 2 | Explain the public goods and common property recourses. | 14 |
| 3 | Explain sustainable development and discuss its rules and indicators. | 14 |
| OR | | |
| 3 | Explain in detail relationship between environment and development. | 14 |
| 4 | Discuss theory for the optimal use of environmental resources. | 14 |
| OR | | |
| 4 | Explain the theories of optimum use of non renewable resources. | 14 |
| 5 | Write short notes : (any two) | 14 |
| | (1) Environment Economics and Mainstream Economics | |
| | (2) Integration of National and Environmental Accounting | |
| | (3) Theories of Renewable Environment Resources | |
| | (4) Unclear Property Rights. | |
